

09.11.2023

To,
BSE Ltd. 25th Floor,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort
Mumbai – 400 001

BSE Scrip Code - 513642

Sub: Newspaper cutting of the Extract of Unaudited Financial Result for the quarter and half year ended 30.09.2023.

Ref: Intimation under Regulation 47(1) (b) of SEBI (LODR) Regulations, 2015.

Dear Sir/ Madam,

Pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015, please find enclosed herewith, copies of the newspaper advertisements publishing the Unaudited Financial Results for the quarter and half year ended 30.09.2023 (approved at the meeting of the Board of Directors of the Company held on Monday, 06.11.2023) published in the following newspapers:

Business Standard Newspaper Ahmedabad Edition and
Loksatta Gujarati Newspaper Vadodara Edition in English language on Wednesday, 08.11.2023.

Kindly take the above on your record and acknowledge the same.

Thanking you,

For Axel Polymers Limited

Jigardan Gadhvi
Company Secretary
M. No. A52215

Encl. As above

TATA CAPITAL HOUSING FINANCE LIMITED

Regd. Address: 11th Floor, Tower A, Peninsula Business Park, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai 400013
Branch Add. Office No 208 To 212, 2nd Floor, Eco Futur, Nr. Khatu Shyamji Temple, New City Light Road, Surat- 395007



NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY

Under Rule 9(1) of the Security Interest (Enforcement) Rules 2002

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
141	10000383	Mrs. Vasantben Ghanshyambhai Gajera Mr. Jatinkumar Ghanshyambhai Gajera	Rs. 9,89,887/- (Rupees Nine Lakh Eighty Nine Thousand Eight Hundred Eighty Seven Only) & 17-11-2021	Rs. 8,60,000/- (Rupees Eight Lakh Six Thousand Only)	Rs. 86,000/- (Rupees Eighty Six Thousand Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Plot No. 158 admeasuring 44.65 Sq. Mtrs., i.e. 53.33 Sq. yard, along with 22.74 Sq. Mtrs., undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereof of the premises/campus known as "KRISHNA RESIDENCY-2", restricted on non-agriculture land for residential use bearing Revenue Survey No.261,263,Block No. 278, Situate at Moje Village: Makana, Taluka: Kamrej, Sub District: Kamrej, District: Surat of Gujarat. Bounded :- East:- Soc Internal Road, West:- Adj. Plot No 143, North:- Adj. Plot No 157, South:- Adj. Plot No 159.

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
142	TCHHF02 16000100 068822 & 10602458 & 10602855	Mr. Vijay Krushnatai Parekh Mr. Gira Vijaybhai Parekh Mr. Parekh Vijay Krushnatai Huf	Rs.30,44,739/- (Rupees Thirty Lakh Forty Four Thousand Seven Hundred Thirty Nine Only) is due and payable by you under loan account No. TCHHF0216000100068822 and an amount of Rs.35,71,933/- (Rupees Thirty Five Lakh Seventy One Thousand Nine Hundred Thirty Three Only) is due and payable by you under loan account No. 10602458 and an amount of Rs.1,50,71,250/- (Rupees One Crore Fifty Lakh Seventy One Thousand Two Hundred Fifty Only) is due and payable by you under loan account No. 10602855, totalling to Rs.2,16,87,922/- (Rupees Two Crore Sixteen Lakh Eighty Seven Thousand Nine Hundred Twenty Two Only) & 25-03-2022	Rs. 1,75,00,000/- (Rupees One Crore Seventy Five Lakh Only)	Rs. 17,50,000/- (Rupees Seventeen Lakh Fifty Thousand Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Plot No. 40, As Per City Survey Chaita No. 36 City Survey 357.22 Sq. Mtrs. Paik Eastern Side Plot No. 40/B of which area admeasuring 191 Sq. Mtrs., along with undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereof of the premises/campus known as "RAVINDRA PARK CO. OP. HO. SOC. LTD", constructed on non-agricultural land for residential use bearing Revenue Survey No. 545/1/A, 545/1/B, 545/1/K, Town Planning Scheme No. 11, Final plot No. 5, Situate at Moje Village: Adajan, Sub-Dist.: Chorasi, District: Surat of Gujarat Bounded :- East :- Adj. Plot No. 41, West :- Adj. Road and then Plot No. 39, North :- Adj. Sneh Smriti Society, South :- Adj. Plot No. 38
Note :- SA filed by the Borrower against TCHFL (SA/238/2023) is pending before DRT Ahmedabad-II, No stay order is passed against TCHFL in the said case

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
143	9571645 & 9570685	Vijaybhai Amarsinhbhai Nesdaiya, Mrs. Ritaben Vijaybhai Nesdaiya	Rs. 20,44,279/- (Rupees Twenty Lakh Forty Four Thousand Two Hundred Seventy Nine Only) is due and payable by you under Agreement No. 9570685 and an amount of Rs. 17,59,971/- (Rupees Seventeen Lakh Fifty Nine Thousand Nine Hundred Seventy One Only) is due and payable by you under Agreement No. 9571645 totalling to Rs. 38,04,250/- (Rupees Thirty Eight Lakh Four Thousand Two Hundred Fifty Only) & 31-05-2021	Rs. 14,40,000/- (Rupees Fourteen Lakh Forty Thousand Only)	Rs. 1,44,000/- (Rupees One Lakh Forty Four Thousand Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Flat No 101 on 1st floor in building No N-2, Buildup area admeasuring 61.38 Sq. Mtrs., undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereof of the premises/campus known as "STAR GALAXY", restricted on non-agriculture land for residential use bearing Revenue Survey No. 1359, Block No. 1316, admeasuring 00.00 Sq. Mtrs., having T.P. Scheme No. 36 (Varyav), Final Plot No 54, Paik Situate at Moje Village: Varyav, Sub District: Adajan, District: Surat of Gujarat. Bounded :- East :- Road, West :- Road, North :- Road, South :- Building No. N-1

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
144	10460466	Mr. Vikash Narad Bharti, Mrs. Latil Devi	Rs. 9,23,456/- (Rupees Nine Lakh Twenty Three Thousand Four Hundred Fifty Six Only) & 17-08-2021	Rs. 5,50,000/- (Rupees Five Lakh Fifty Thousand Only)	Rs. 55,000/- (Rupees Fifty Five Thousand Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Plot No. 454 (registered as per K.J.P. Block No. 59/A/454) admeasuring 40.15 Sq. Mtr. along with road, COP and undivided share and proportionate share in the land and all internal and external rights thereof of the premises/campus known as "SHREE NILKANTH RESIDENCY", non-agricultural land for residential use bearing Revenue Survey No. 108/1, 107/paik, 109, 118 having Block No. 59/A admeasuring 31161 sq. mtr. Situate at Moje Village: Syadla, sub-Dist: Olpad, District: Surat of Gujarat, Bounded :- East :- Plot No. 453, West :- Plot No. 455, North :- Plot No. 434, South :- Adj. Road

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
145	TCHHL06 66000100 090436	Vikram Hariram Vishvakarma, Kesharidevi Vikram Vishvakarma	Rs. 10,23,368/- (Rupees Ten Lakh Twenty Three Thousand Three Hundred Sixty Eight Only) & 28-01-2023	Rs. 6,57,000/- (Rs. Six Lakh Fifty Seven Thousand Only)	Rs. 65,700/- (Rupees Sixty Five Thousand Seven Hundred Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Plot No. 75 admeasuring 48 sq. yard i.e. 40.13 sq. mts., As Per K.J.P. Block No. 459/A/75 admeasuring 40.06 sq. mts. (As Per Revenue New Block No. 2131 admeasuring 40.00 sq. mts.). Along with 16.38 sq. mts. undivided share in the land of Road & C.O.P. in "ARADHNA RESIDENCY", Situate at Block No. 459/A admeasuring He. 1-56 Are 17 sq. mts. i.e. 15617 sq. mts., of Moje Village Haldharu, Ta: Kamrej, Dist: Surat. Bounded :- East :- Adj. Plot No. 74, West :- Adj. Plot No. 76, North :- Adj. Plot No. 47, South :- Adj. Society's Internal Road

At the Auction, the public generally is invited to submit their bid(s) personally. The Borrower(s)/Co-Borrower (s) are hereby given last chance to pay the total dues with further interest within 15 days from the date of publication of this notice, failing which the Immovable Property will be sold as per schedule. The E auction will be stopped if, amount due as aforesaid, with interest and costs (including the cost of the sale) are tendered to the Authorised Officer or proof is given to his satisfaction that the amount of such secured debt, interest and costs has been paid before the date of the auction.

No officer or other person, having any duty to perform in connection with this sale shall, however, directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the Immovable Property sold.

The sale shall be subject to the conditions prescribed in the Security Interest (Enforcement) Rules, 2002 and to the following further conditions:

NOTE: The E-auction of the properties will take place through portal <http://bankauctions.in/> on 24-11-2023 between 2.00 PM to 3.00 PM with limited extension of 10 minutes each.

Terms and Condition: 1. The particulars specified in the Schedule herein below have been stated to the best of the information of the undersigned, but the undersigned shall not be answerable for any error, misstatement or omission in this proclamation. In the event of any dispute arising as to the amount bid, or as to the bidder, the Immovable Property shall at once again be put up to auction subject to the discretion of the Authorised Officer. 2. The Immovable Property shall not be sold below the Reserve Price. 3. Bid Increment Amount will be: Rs.10,000/- (Rupees Ten Thousand Only). 4. All the Bids submitted for the purchase of the property shall be accompanied by Earnest Money as mentioned above by way of a Demand Draft favoring the "TATA CAPITAL HOUSING FINANCE LTD." Payable at Branch address. The Demand Drafts will be returned to the unsuccessful bidders after auction. For payment of EMD through NEFT/RTGS/IMPS, kindly contact Authorised Officer. 5. The highest bidder shall be declared as successful bidder provided always that he/she is legally qualified to bid and provided further that the bid amount is not less than the reserve price. It shall be in the discretion of the Authorised Officer to decline acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so. 6. For reasons recorded, it shall be in the discretion of the Authorised Officer to adjourn/discontinue the sale. 7. Inspection of the Immovable Property can be done on 16-11-2023 between 11 AM to 5.00 PM with prior appointment. 8. The person declared as a successful bidder shall, immediately after such declaration, deposit twenty-five per cent of the amount of purchase money/bid which would include EMD amount to the Authorised Officer within 24hrs and in default of such deposit, the property shall forthwith be put to fresh auction/Sale by private treaty. 9. In case the initial deposit is made as above, the balance amount of the purchase money payable shall be paid by the purchaser to the Authorised Officer on or before the 15th day from the date of confirmation of the sale of the property, exclusive of such day, or if the 15th day be a Sunday or other holiday, then on the first office day after the 15th day. 10. In the event of default of any payment within the period mentioned above, the property shall be put to fresh auction/Sale by private treaty. The deposit including EMD shall stand forfeited by TATA CAPITAL HOUSING FINANCE LTD and the defaulting purchaser shall lose all claims to the property. 11. Details of any encumbrances, known to the TATA CAPITAL HOUSING FINANCE LTD, to which the property is liable: as per table above. Claims, if any, which have been put forward to the property and any other known particulars bearing on its nature and value: as per table above. The Intending Bidder is advised to make their own independent inquiries regarding encumbrances on the property including statutory liabilities areas of property tax, electricity etc. 12. For any other details or for procedure online training on e-auction the prospective bidders may contact the Service Provider, M/s. 4Closeure, Block No.605 A, 6th Floor, Maltrivnam Commercial Complex, Ameerpet, Hyderabad 500038 through its coordinators Mr Arjit Kumar Das, 8142000725, 814200066, 814200062 Email - arjit@bankauctions.in and Email : info@bankauctions.in or Manish Bansal, Email Id Manish.Bansal@tatacapital.com Authorised Officer Mobile No 8589983696. Please send your query on WhatsApp Number 9999076669. 13. TDS of 1% will be applicable and payable by the highest bidder over the highest declared bid amount. The payment needs to be deposited by highest bidder in the PAN of the owner/ borrower(s) and the copy of the challan shall be submitted to our company. 14. Please refer to the below link provided in secured creditor's website <http://surl.li/msqmgd> for the above details. 15. Kindly also visit the link: <https://www.tatacapital.com/property-disposal.html>

Please Note - TCHFL has not engaged any broker/agent apart from the mentioned auctioning partner for sale/auction of this property. Interested parties should only contact the undersigned or the Authorised officer for all queries and enquiry in this matter.

Place: Surat
Date- 08-11-2023

Sd/-
Authorised Officer
Tata Capital Housing Finance Ltd.

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
146	9998871	Mr. Vimalkumar Ashokbhai Kalariya Mrs. Pragna Vimalbhai Patel	Rs. 8,38,547/- (Rupees Eight Lakh Thirty Eight Thousand Five Hundred Forty Seven Only) & 17-06-2021	Rs. 8,07,000/- (Rupees Eight Lakh Seven Thousand Only)	Rs. 80,700/- (Rupees Eighty Thousand Seven Hundred Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Flat no. 301 on 3rd Floor in as per site Building No. "B/3" and known B/4 super built up area admeasuring 73.51 Sq. Mtrs., i.e. 791.00 Sq. foot, and built up area admeasuring 44.11 Sq. Mtrs., i.e. 474.60 sq. foot, along with undivided proportionate share in the underneath land of the building and all internal and external rights thereof of the premises/campus known as "SAURASHTRA GREENCITY", constructed on non-agriculture land for residential use bearing Block No. 119/A, admeasuring 13860.00 Sq. Mtrs., & Block No. 120, admeasuring 21787.00 Sq. Mtrs., Totally admeasuring 35647.00 Sq. Mtrs., Situate at Moje Village: Umra, Taluka: Olpad, District: Surat of Gujarat. Bounded :- East :- Adj. Block No. 123, West :- Adj. C.O.P., North :- Adj. Road, South :- Adj. Road.

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
147	10000554	Mr. Vimalkumar Ashokbhai Kalariya, Mrs. Pragna Vimalbhai Patel	Rs. 8,33,204/- 17-06-2021	Rs. 7,90,000/- (Rupees Seven Lakh Eighty Thousand Only)	Rs. 78,000/- (Rupees Seventy Eight Thousand Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Flat no. 302 on 3rd Floor in as per site Building No. "B/5" and known B/6 super built up area admeasuring 73.51 Sq. Mtrs., i.e. 791.00 Sq. foot, and built up area admeasuring 44.11 Sq. Mtrs., i.e. 474.60 sq. foot, along with undivided proportionate share in the underneath land of the building and all internal and external rights thereof of the premises/campus known as "SAURASHTRA GREENCITY", constructed on non-agriculture land for residential use bearing Block No. 119/A, admeasuring 13860.00 Sq. Mtrs., & Block No. 120, admeasuring 21787.00 Sq. Mtrs., Totally admeasuring 35647.00 Sq. Mtrs., Situate at Moje Village: Umra, Taluka: Olpad, District: Surat of Gujarat. Bounded :- East :- Adj. Block No. 123, West :- Adj. C.O.P., North :- Adj. Road, South :- Adj. Road

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
148	10282142	Mr. Bhavesh Suresh Jogiya, Mrs. Krishna Bhavesh Jogiya	Rs. 10,45,979/- (Rupees Ten Lakh Forty Five Thousand Nine Hundred Seventy Nine Only) & 13-10-2021	Rs. 6,50,000/- (Rupees Six Lakh Fifty Thousand Only)	Rs. 65,000/- (Rupees Sixty Five Thousand Only)	Physical

Description of the Immovable Property: All that piece and parcel of the All the Piece And Parcel Of Immovable Property Bearing Plot No. 10, total area admeasuring 64.79 Sq. Mtr., i.e. 77.75 Sq. Yard, Along With Road, C.O.P area Adm. 40.12 sq. meters and along with Undivided Share Proportionate Share In The Land And All Internal And External Rights Thereof Of The Premises/ Campus Known As "MANSAROVAR VILLA", Situate At Revenue Survey No./Block No. 335 of which area admeasuring Hicare-Aare 4-14-81 sq. mtr. i.e. 41481 sq. mtr and aakar Rs. 24.87 paisa, from North- East side area admeasuring 10500 sq. mtr. for residential use, Of Moje Village : Uliyadra, Ta : Ankleshwar, Dist : Bharuch of Gujarat. Bounded :- East :- Society Adjoining Road, West :- Adj. Block No. 335, North :- Plot No. 9, South :- Plot No. 11

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
149	10420751	Mr. Brijesh Anumandla, Mrs. Srijata Brijesh Anumandla	Rs. 20,20,562/- (Rupees Twenty Lakh Twenty Thousand Five Hundred Sixty Two Only) & 19-05-2021	Rs. 8,00,000/- (Rupees Eight Lakh Only)	Rs. 80,000/- (Rupees Eighty Thousand Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Plot No. 99, Admeasuring 68.55 sq. mtrs., i.e. 78 sq. ft. 18 Foot Wide and 41 Foot Long undivided share proportionate share in the underneath land of the building and all internal and external rights thereof of the premises/campus known as "SAI DARSAN RESIDENCY", restricted on non-agriculture land for residential use bearing Revenue Survey No. 204, 205/B, Adm. 24792 sq. mt. Situate at Moje Village: Kapoora, Taluka: Ankleshwar, Sub Dist. Ankleshwar, District: Surat of Gujarat. Bounded :- East :- Adj. Society Road, West :- Adj. Plot No.84, North :- Adj. Plot No.98, South :- Adj. Plot No. 100

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
150	10470292	Mrs. Gangaben Pravinbhai Solanki Mr. Kalpeshkumar Pravinbhai Solanki	Rs. 10,59,238/- (Rupees Ten Lakh Fifty Nine Thousand Two Hundred Thirty Eight Only) & 11-05-2021	Rs. 6,85,000/- (Rupees Six Lakh Eighty Five Thousand Only)	Rs. 68,500/- (Rupees Sixty Eight Thousand Five Hundred Only)	Physical

Description of the Immovable Property: All the rights, piece & parcel of Immovable property bearing Plot No.38 admeasuring 64.79 sq. mtrs., i.e. 77.75 sq. yard, along with 40.12 sq. mtrs., undivided share proportionate share in the underneath land and all internal and external rights thereof of the premises/campus known as "MANSAROVAR VILLA", restricted on non-agriculture land for residential use bearing R. S. No/Block No.335, (after re survey new block no.635 admeasuring 41481 sq. mtrs., Paik North-West side admeasuring 10500 sq. mtrs.), Situate at Moje Village:Uliyadara, Sub District: Ankleshwar, District: Bharuch of Gujarat Bounded :- East :- Plot No. 53, West :- Adj. Society Road, North :- Plot No. 37, South :- Plot No. 35.

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
151	10207209 & 10207957	Mr. Nihinkumar Narsinh Sunava, Mrs. Hetalben Nihinkumar Sunava	Rs. 12,47,438/- (Rupees Twelve Lakh Forty Seven Thousand Four Hundred Thirty Eight Only) is due and payable by you under Agreement No. 10207209 and an amount of Rs. 9,91,531/- (Rs. Nine Lakh Ninety One Thousand Five Hundred Thirty One Only) is due and payable by you under Agreement No. 10207957 totalling to Rs. 22,38,969/- (Rupees Twenty Two Lakh Thirty Eight Thousand Nine Hundred Sixty Nine Only) & 19-02-2020	PLOT NO:131 - Rs.5,85,000/-	PLOT NO:131 - Rs.58,500/-	Physical

Description of the Immovable Property: Property 1 All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 131 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block No. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Society Road, West :- Plot no. 130
Property 2: All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 130 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block no. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Plot no. 130, West :- Margin Space than Common Plot

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
152	10207209 & 10207957	Mr. Nihinkumar Narsinh Sunava, Mrs. Hetalben Nihinkumar Sunava	Rs. 12,47,438/- (Rupees Twelve Lakh Forty Seven Thousand Four Hundred Thirty Eight Only) is due and payable by you under Agreement No. 10207209 and an amount of Rs. 9,91,531/- (Rs. Nine Lakh Ninety One Thousand Five Hundred Thirty One Only) is due and payable by you under Agreement No. 10207957 totalling to Rs. 22,38,969/- (Rupees Twenty Two Lakh Thirty Eight Thousand Nine Hundred Sixty Nine Only) & 19-02-2020	PLOT NO:131 - Rs.5,85,000/-	PLOT NO:131 - Rs.58,500/-	Physical

Description of the Immovable Property: Property 1 All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 131 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block No. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Society Road, West :- Plot no. 130
Property 2: All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 130 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block no. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Plot no. 130, West :- Margin Space than Common Plot

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
153	10207209 & 10207957	Mr. Nihinkumar Narsinh Sunava, Mrs. Hetalben Nihinkumar Sunava	Rs. 12,47,438/- (Rupees Twelve Lakh Forty Seven Thousand Four Hundred Thirty Eight Only) is due and payable by you under Agreement No. 10207209 and an amount of Rs. 9,91,531/- (Rs. Nine Lakh Ninety One Thousand Five Hundred Thirty One Only) is due and payable by you under Agreement No. 10207957 totalling to Rs. 22,38,969/- (Rupees Twenty Two Lakh Thirty Eight Thousand Nine Hundred Sixty Nine Only) & 19-02-2020	PLOT NO:131 - Rs.5,85,000/-	PLOT NO:131 - Rs.58,500/-	Physical

Description of the Immovable Property: Property 1 All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 131 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block No. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Society Road, West :- Plot no. 130
Property 2: All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 130 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block no. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Plot no. 130, West :- Margin Space than Common Plot

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
154	10207209 & 10207957	Mr. Nihinkumar Narsinh Sunava, Mrs. Hetalben Nihinkumar Sunava	Rs. 12,47,438/- (Rupees Twelve Lakh Forty Seven Thousand Four Hundred Thirty Eight Only) is due and payable by you under Agreement No. 10207209 and an amount of Rs. 9,91,531/- (Rs. Nine Lakh Ninety One Thousand Five Hundred Thirty One Only) is due and payable by you under Agreement No. 10207957 totalling to Rs. 22,38,969/- (Rupees Twenty Two Lakh Thirty Eight Thousand Nine Hundred Sixty Nine Only) & 19-02-2020	PLOT NO:131 - Rs.5,85,000/-	PLOT NO:131 - Rs.58,500/-	Physical

Description of the Immovable Property: Property 1 All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 131 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block No. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Society Road, West :- Plot no. 130
Property 2: All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 130 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block no. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Plot no. 130, West :- Margin Space than Common Plot

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
155	10207209 & 10207957	Mr. Nihinkumar Narsinh Sunava, Mrs. Hetalben Nihinkumar Sunava	Rs. 12,47,438/- (Rupees Twelve Lakh Forty Seven Thousand Four Hundred Thirty Eight Only) is due and payable by you under Agreement No. 10207209 and an amount of Rs. 9,91,531/- (Rs. Nine Lakh Ninety One Thousand Five Hundred Thirty One Only) is due and payable by you under Agreement No. 10207957 totalling to Rs. 22,38,969/- (Rupees Twenty Two Lakh Thirty Eight Thousand Nine Hundred Sixty Nine Only) & 19-02-2020	PLOT NO:131 - Rs.5,85,000/-	PLOT NO:131 - Rs.58,500/-	Physical

Description of the Immovable Property: Property 1 All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 131 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block No. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Society Road, West :- Plot no. 130
Property 2: All the piece & parcel of the immovable property bearing constructed house on Plot No. 130 Admeasuring plot area 18 x 35 i.e. 58.74 Sq. Mtr. located in "Shilalekh Residency" Situate in land bearing Block no. 118 admeasuring 15884 Sq. Mtr., of Moje Village Uliyadara, Ta. Ankleshwar, Dist: Bharuch Gujarat. Bounded As: North :- Society Road, South :- Margin Space than Common Plot, East :- Plot no. 130, West :- Margin Space than Common Plot

Sr. No.	Loan A/c No.	Name of Borrower(s)/ Co-Borrower(s) Legal Heir(s)/ Legal Representative/ Guarantor(s)	Amount as per Demand Notice and Date of Demand Notice	Reserve Price	Earnest Money	Type of Possession
156	10207209 & 10207957	Mr. Nihinkumar Narsinh Sunava, Mrs. Hetalben Nihinkumar Sunava	Rs. 12,47,438/- (Rupees Twelve Lakh Forty Seven Thousand Four Hundred Thirty Eight Only) is due and payable by you under Agreement No. 10207209 and an amount of Rs. 9,91,531/- (Rs. Nine Lakh Ninety One Thousand Five Hundred Thirty One Only) is due and payable by you under Agreement No. 10207957 totalling to Rs. 22,38,969/- (Rupees Twenty Two Lakh Thirty			

